

ડેઝલ જવેલર્સ નામના કારખાનામાંથી રૂ.૧,૪૧,૮૧,૪૬૭/- મત્તાની ગોલ્ડની ડસ્ટની ચોરી કરનાર
ગેંગને ઝડપી પાડતી, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ.

સુરત શહેરના વરાછા પો.સ્ટે. વિસ્તારમાં તા.૧૫/૦૨/૨૦૨૦ ના રોજ વરાછા રોડ ઘોળી કુઇ, લક્ષ્મી હોટલની બાજુમા માધવ ચેમ્બર્સ ગાળા નં. ૧૦૧ માં આવેલ ડેઝલ જવેલર્સ નામના ડાયમંડ ગોલ્ડ જવેલરી બનાવતા કારખાનામાંથી રૂ.૧,૪૧,૮૨,૪૫૭/- ની મત્તાની ગોલ્ડની ડસ્ટની ચોરી થયેલ. જે અંગે વરાછા પો.સ્ટે. ૧૧૨૧૦૦૬૦૨૦૦૩૫૬/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ. શોધી કાઢવા સારૂ ક્રાઈમ બ્રાંચના પો.સ.ઇ. એમ.એસ.ત્રીવેદી પો.સ.ઇ. વી.વી.ભોલા, તથા પો.સ.ઇ. સી.આર.દેસાઇ નાઓની અલગ અલગ ટીમો આરોપીઓને શોધી કાઢવા અંગેના વર્ક આઉટમાં હતી દરમ્યાન હે.કો.મનોજ તુકારામ તથા પો.કો મહેન્દ્ર રમેશભાઇ નાઓને મળેલ બાતમી આધારે ભાગળ શીવમ કોમ્પ્લેક્ષ બીજા માળે, ભાગળ ચાર રસ્તા જીવરાજ યાની બાજુની ગલીમા મહીધરપુરા ખાતેથી નીચે જણાવેલ આરોપીઓને (૧)સોનાની બંગડી નં. ૧૦,૭૮૫ ગ્રામ, ૬૦૦ મી.લી. કિ.રૂપીયા ૨૭,૭૬,૪૮૩/- (૨) રોકડા રૂપીયા ૧,૭૪,૦૦૦/- (૩) કુલ મોબાઇલ ફોન નં. ૧૪ કિ.રૂ. ૧,૨૭,૫૦૦/- (૪) ગુનામાં કબ્જે કરવામાં આવેલ આવેલ છે અને વરાછા પો.સ્ટે. ૦૩૫૬/૨૦૨૦ ઇ.પી.કો. ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના આરોપી (૧) લાલન ઇન્સાફાઅલી શેખ ઉ.વ.૩૦ ધંધો. સોની કામ રહે. શીવમ કોમ્પ્લેક્ષ બીજા માળે. ભાગળ ચાર રસ્તા જીવરાજ યાની બાજુની ગલીમા મહીધરપુરા સુરત. મુળ રહે.ગામ ઇસને, થાના.મુન્તેસર જી.વર્ધમાન (૨) અરમાન ઉર બાબુ જહાગીર મંડલ ઉ.વ. ૨૩ ધંધો. સોનીકામ રહે.મકાન નં. ૫૬, દાતાર સોસાયટી મુન્નાભાઇના મકાનમા ઉન પાટીયા, સુરત શહેર. મુળ રહે. દારપડા થાના. બલગાર પો.સ્ટે. કોબ્રા પાસપાડા જી.હુગલી (૩) સાકીબ ઇસ્માઇલ શેખ ઉ.વ. ૨૧ ધંધો. સોનીકામ રહે.મકાન નં. ૫૬, દાતાર સોસાયટી મુન્નાભાઇના મકાનમાં ઉન પાટીયા, સુરત શહેર. મુળ રહે. સરાંદા થાના.બલાગર પો.સ્ટે. કોબ્રા પાસપાડી જી. હુગલી (૪) રાહુલદીન લતીમઉદ્દીન શેખ ઉ.વ.૨૭ ધંધો. સોનીકામ રહે.મકાન નં. ૫૬, દાતાર સોસાયટી મુન્નાભાઇના મકાનમા ઉન પાટીયા, સુરત શહેર. મુળ રહે. દુર્ગાડાનાગામ થાના મેમારીગામ પોસ્ટ મેમારી જી.વર્ધમાન (૫) નુરહસન ફીરોજઉદ્દીન શેખ ઉ.વ.૩૦ ધંધો સોનીકામ રહે.મકાન નં. ૫૫, દાતાર સોસાયટી મુન્નાભાઇ ના મકાનમા ઉન પાટીયા, સુરત શહેર. મુળ રહે-સૌરફ દૌલતપુર થાના-દાતપુર પોસ્ટ બાબાલાન જી. હુગલી (૬) પ્રાશંતજી દિપીલ દાસ ઉ.વ.૩૦ રહે. શિવમ કોમ્પ્લેક્ષ બીજા માળે ભાગળ ચાર રસ્તા જીવરાજ યાની બાજુની ગલીમા મહીધરપુરા, સુરત. મુળ રહે. બેઠેપાડા ચંદ્રાહાટી થાના.પાંડવા જી. હુગલી (૭) સુજય ઉર્ફ બાબુ સતન દાસ ઉ.વ.૩૫ ધંધો.કોન્દ્રાક્ટર રહે. મકાન નં. ૯/૩૪૭, રૂમ નં. સી-૧૯, ચોથો માળ રજનીગંધા એપાર્ટમેન્ટ, ચકાવાળા શેરી, વાડી ફળીયા, જલારામ ડેરીની બાજુમાં, મહીધરપુરા, સુરત મુળ રહે. પારોલીગામ થાના.કાટવા પોસ્ટ.કાટવા જી.વર્ધમાન (૮) દેવાઆશીષ

જાનોકી સામંતો ઉ.વ.૩૪ ધંધો-સોનીકામ રહે. બિડીંગ નં.બી/૮૨, રૂમ નં. ૧૭, કોસાડ આવાસ અમરોલી, સુરત મુળ રહે. કાલારીયાગામ થાના. તારકેસર પોસ્ટ કેશવચોક જી.હુગલી(૯) જાફર હુસેનઅલી શેખ ઉ.વ.૨૭ ધંધો-સોનીકામ રહે. રૂમ નં. ૧૦૨, અબ્દુલા એપાર્ટમેન્ટ પહેલો માળ રામપુરા પેટ્રોલ પંપ પાસે મહીધરપુરા, સુરત.મુળ રહે. દફરપુરઆમ થાના. કાલના પોસ્ટ. બોહરીપુરી જી. વર્ધમાન મજકુર આરોપીઓની પુછપરછ કરતા પકડાયેલ આરોપીઓ પૈકી લાલન શેખ તથા અમરાન ઉફ્ફ બાબુ નાઓએ દેવુ થઈ ગયેલ.મજકુર બન્ને આરોપીઓ સોની કામ સાથે સંકળાયેલ જેથી બન્ને આરોપીઓને કોઈ સોનાની ફેક્ટરીમાં ચોરી કરી, તેની ડસ્ટમાંથી સોનુ બનાવી વેચી રૂપીયા મેળવવાનુ નક્કી કરેલ આ માટે મજકુર આરોપીઓના સોની કામ માટી કારીગરો પુરા પાડતા સુજય ઉફ્ફ બાબુનો સંપર્ક કરી કોઈ તેના કારીગરો મારફતે ચોરી થઈ શકે તેવી જગ્યા જણાવવા કહેલ. ત્યારબાદ સુજય ઉફ્ફ બાબુનાએ દેવાઆશીષ સામંતોનો સંપર્ક કરી બોલાવેલ અને દેવા આશીષ સામંતો ચાર વર્ષ અગાઉ ફરીયાદીશ્રીના ઉપરોક્ત ખાતામાં નોકરી કરી ચુકેલ હોય તેની સંપુર્ણ માહિતી આપેલ ત્યારબાદ(૧) રાહુલુદીન શેખ (૨) સાકીબ શેખ (૩) નુરહસન (૪) લાલન શેખ (૫) અરમાર ઉફ્ફ બાબુ નાઓને ટીપ આપનાર (૬) સુજય ઉફ્ફ બાબુ (૭) દેવા આશીષ સામંતો નાઓએ જગ્યા બતાવેલ તથા ચોરી દર મહીનાની પહેલી અથવા બીજી તારીખે કરવાથી વધારે માલ મળી રહે તેમ જણાવેલ. ત્યારબાદ તા.૦૨/૦૨/૨૦૨૦ ના રોજ તમામ ઉપરોક્ત આરોપીઓ ચોરીને અંજામ આપવા ગયેલ પરંતુ સફળતા મળી નહી. ત્યારબાદ ફરી.થી બનાવના દિવસે રાત્રીના લાલન શેખ તથા અરમાન ઉફ્ફ બાબુ તેઓની મોટર સાઇકલ તથા એક્ટીવા લઈ(૧) રાહુલુદીન શેખ (૨) સાકીબ શેખ (૩) નુરહસન શેખ નાઓને ચોરીની જગ્યાથી થોડે દુર ઉતારી તેઓ રેલ્વે સ્ટેશન ચાલી ગયેલ ત્યારબાદ સાકીબ તથા રાહુલુદીન કારખાનામા દાખલ થયેલ અને નુરસહન નીચે વોચમા ઉભો રહેલ.ચોરીનુ કામ પુરૂ થતા લાલન શેખ તથા પ્રશાન જીતદાસ તેઓને લેવા ગયેલ અને ત્યાંથી પોત પોતાના ઘરે ચાલી ગયેલ. બીજા દિવસે સવારે આરોપીઓએ જાફર હુસેન અલી શેખ નાઓને ચોરી કરેલ સોનાની ડસ્ટ આપતા જાફર શેખનાઓ સોનાની ડસ્ટ ઓગાળી લગડી બનાવી આરોપીઓને આપેલ અને તેમાંથી એક લગડી વેચી બે લાખ રૂપીયા મેળવેલ તે મળેલ રૂપીયા તથા સોનાની લગડીના ભાગ પાડવા તમામ આરોપીઓ લાલન શેખનાઓના ત્યાં ભેગા થયેલ હોવાની હકીકત જાણવા મળેલ જે હકીકત આધારે ઉપરોક્ત વણશોધાયેલ ગુન્હો શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.